

સંવાદિતાનો પ્રારંભ ધરથી : ધરસભાની પરિવર્તનશીલ શક્તિ

બાવાનુવાદ સંકલન : સંગીતાબહેન મોદી (અમદાવાદ)

હું મારા ફોનમાં નોટ્સની એપમાં Connections (યાદગાર પળો) નામની એક યાઈ રાખ્યું છું કે જે માં હું મારી એવી પળોને નોંધી લઈ છું કે જ્યારે મને આસપાસના વિશ્વ સાથે હિવ્યતાનો અને લોકો સાથે તાદાત્મ્યનો અનુભવ થયો હોય. આ યાઈમાં હાસ્યની પળો, એવા સંવાદો કે જ્યાં મારી વાતોને સાંભળવામાં અને સ્વીકારવામાં આવી હોય અને આત્મિક સંબંધોની યાદોનો સમાવેશ પણ થયેલો હોય છે.

આ યાઈ ઉપર નજર કરતાં મને એક ખાસિયત નોંધાઈ કે, આમાંની મોટા ભાગની યાદો મારાં માતા-પિતા સાથે સંકળાયેલી હતી. આથી મને જ્યાલ આવ્યો કે, માતા-પિતા તેમજ બાળકોની સંભાળ રાખતાં વડીલોનો તેઓનાં સંતાનોનાં જીવન ઉપરકેટલો પ્રભાવ પડતો હોય છે !

આપણે આની અસર અનુભવોના ફ્લક પર જોઈ શકીએ છીએ કે, જેઓને માતા-પિતા સાથે ગાડ અને સકારાત્મક સંબંધો છે એવા વયસ્કોથી માંડીને જેઓ હજુ પણ પોતાનાં માતા-પિતા સાથેની ભાવનાત્મક પીડામાંથી બહાર આવી રહ્યા છે ; તેની વચ્ચે જ બધાં હોય છે. તો, માતા-પિતા અને વડીલો તેમનાં સંતાનો સાથે ગાડ સંબંધ કેવી રીતે વિકસાવી શકે ? અને મારાં માતા-પિતા મારી યાદગાર પળોની યાઈમાં કેવી રીતે સ્થાન પામ્યાં ?

આનો જીવાબ એક સામાન્ય પ્રક્રિયામાં રહેલો છે કે, જેને આપણે ‘ધરસભા’ તરીકે જાણીએ છીએ. ‘ધરસભા’ એ એક એવું અઠવાડિક મિલન છે કે, જે માં પરિવારનાં બધાં સભ્યો બેગાં થઈને એકબીજાં સાથે આત્મીયતાથી જોડાઈ પોતાના જીવન વિશે વાતો કરે છે અને માર્ગદર્શન મેળવે છે. ધરસભા હું મેશની જે મ ધરમાંદિર સમક્ષ દર અઠવાડિયે નિયત સમયે ગોઠવી શકાય અથવા તે અન્ય રીતે જે મ કે, મનગમતાં રાત્રિભોજન બાદ આત્મીયસભર ગોષ્ઠિ સ્વરૂપે પણ કરી શકાય. ધરસભાના સમય અને સ્થાન કરતાં પરસ્પર આવું આત્મીયતાસભર જોડાણ ઊભું થાયતે વધુ અગત્યનું હોય છે.

જ્યારે માતા-પિતા અને વડીલો તેમનાં સંતાનો સાથે આવી ધરસભામાં ભાગ લેવાનું નક્કી કરે છે, ત્યારે તે વણકદ્વા ઘણા સંદેશ કરી જાય છે. જેવા કે, ‘મને તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તેની સાથે નિસબત છે.’ ‘હું ગમે તેટલો વસ્ત હોઈશ તો પણ તમારા માટે સમય અવશ્ય ફાળવીશ’ ને ‘તમે ચાહો ત્યારે મારી પાસે આવી શકો છો, હું ચોક્કસપણે તમને સાંભળીશ.’ માતા-પિતા અને સંતાનો વચ્ચેના આવા નિયમિત સંવાદોથી સમય જતાં આપણા મગજના બંધારણમાં

neuroplasticity (ન્યૂરોપ્લાસ્ટિસિટી) દ્વારા સકારાત્મક બદલાવ આવી શકે છે. Neuroplasticity (ન્યૂરોપ્લાસ્ટિસિટી) એ મગજની સમયની સાથે બદલાવ લાવવાની અને સ્વીકાર કરવાની એદ્દભુત ક્ષમતા છે. આપણે આપણાં સંતાનો સાથે જે ટલા સકારાત્મક રીતે વર્તીશું, તે ટલાં આપણાં મગજ સ્વર્થ સંબંધો બાંધવા ને સ્વીકારવા સક્રમ બનશે.

મતલબ કે, સંતાનો સાથેના આપણા સંબંધો તેઓના જીવનમાં સંબંધો જાળવવા માટેની છાપ બની રહે છે. આપણા વર્તનાના અવલોકન દ્વારા તેઓ પોતે સંબંધોમાં કેવું વર્તવું જોઈએ અને કેટલો સ્વીકાર કરવો જોઈએ તે વિવેક શીખે છે. જ્યારે સંતાનો એવો અનુભવ કરે છે કે, વડીલો તે મને ધ્યાન દઈને સાંભળે છે, તે મની વાતોને અનુમોદન આપે છે અને તેઓ સાથે તે મનો કીમતી સમય ફાળવે છે ; ત્યારે તેઓ જાણ્યે-અજાણ્યે પણ તંદુરસ્ત સંબંધો કેવા હોય તે શીખે છે. આપણાં સંતાનો સાથે આવો કીમતી સમય ફાળવીને આપણે તેઓને પરિપક્વ મિત્રતા અને ગાડ સ્નેહ સંબંધો વિકસાવવા માટે તૈપાર કરીએ છીએ.

સંતભગવંત સાહેબદાદા પણ દુંમેશાં ભારપૂર્વક કહે છે કે, ‘સત્સંગનો પ્રારંભ તો ધરથી જ થાય છે.’ ધરસભા આપણાં ધરોમાં આદ્યાત્મિકતા લાવે છે અને આપણાને આપણાં સંતાનો સાથેના સ્વર્થ સંવાદોને પ્રોત્સાહન આપે છે. તેમજ આપણાં સંતાનોના જીવનમાં ઘટ્ટી ઘટનાઓ બાબતે આપણાને થતી ચિંતા ઘટાડે છે.

એક સત્સંગીએ ધરસભાના પરિણામે પોતાના ૧૧ વર્ષના દીકરા સાથેના સંબંધમાં જે સુધારો થયો તેનો ખૂબ પ્રેરણાદાયી પ્રસંગ જણાવ્યો હતો. અગાઉ, આ શરમાળ દીકરા સાથે મુક્ત મને સંવાદ કરવો એ તેમના માટે મુશ્કેલ બાબત હતી. પરંતુ, ધરસભા શરૂ કર્યા પછી તે મને તેમના દીકરાની યોજનાઓ, મુશ્કેલીઓ અને તેના ભિત્રો અંગે ખૂલ્લીને ચર્ચા કરવાનું ઠેકાણું મળી ગયું. આ સત્સંગીએ આગળ જણાવ્યું કે, ‘મને તો એવું લાગે છે કે, ધરસભા ચાલુ કર્યા પહેલાં જાણે હું મારા દીકરાને જાણું જ નહોતો.’

ધરસભા એ પરિવારમાં સંવાદિતા સ્થાપવાનું અને સંબંધોને ગાડ બનાવવાનું અપાર સામર્થ્ય ધરાવે છે. અને જ્યારે આપણે આપણાં ધરોમાં સંવાદિતાને પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે આપણા જીવનના દરેક પાસાં ઓમાં સકારાત્મકતાનો ઉજાસ જગદળવા માંડે છે.

(સહેતી શેફાના બ્રાહ્મનિર્ધરનાં. '૨૩' અંગમાં પ્રકાશિત મૂળ અંગેજ લેખનો ભાવાનુવાદ)